

SML/SE/2024-25/011

Date: May 23,2024

To,

Bombay Stock Exchange Limited

1st Floor, New Trading Ring,
Rotunda Building, P. J. Tower,

National Stock Exchange of India Ltd.,
Exchange Plaza, C-1, Block G,
BandraKurla Complex,

Dalal Street,

Mumbai – 400 001.

Bandra (E),

Mumbai – 400 051

Scrip Code: 533275 Company Symbol: SHAH

SUB.: SUBMISSION OF COPY OF ADVERTISEMENT FOR FINANCIAL RESULTS FOR THE QUARTER AND FINANCIAL YEAR ENDED MARCH 31, 2024.

With reference to above, we are enclosing copy of Advertisement for Financial Results published in Business Standard (English) and Jai Hind (Gujarati) on May 23, 2024 for the quarter and Financial year ended March 31, 2024 of Shah Metacorp Limited (Formerly known as Gyscoal Alloys Limited) pursuant to Regulation 47 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 for your information.

Kindly take this on your records.

Thanking you.

Yours faithfully,

For Shah Metacorp Limited (Formerly known as Gyscoal Alloys Limited),

Hiral Patel Company Secretary Encl: As above

> Regd. Office & Factory:

Plot No. 2/3 GIDC Ubkhal, Kukarwada, Tal. Vijapur, Dist. Mehsana, Kukarwada,(GJ.) (IN.)-382830
◆91 99745 70000 ☐ info@shahgroupco.com

Q 2nd Floor, Mrudul Tower . B/h-Times of India, Ashram Road, Ahmedabad(GJ.) (IN.)-380009

Particulars

(after exceptional items)

Particulars

Total Income From Operations

Net Profit / (Loss) before tax

Net Profit / (Loss) after tax

Total Comprehensive Income

Place: Ahmedabad

Date: 21/05/2024

Guarantors :

Sr.

No.

Total Income From Operation

Net Profit / (Loss) for the period (before tax and exceptional items) Net Profit / (Loss) for the period before Tax

Net Profit for the period after tax (after Exceptional items)

Paid up Equity Share Capital (Face Value of Rs.1/- each)

Borrower / Guarantors

Office: C-603, Diamond World Centre, Mini Bazar, Mangadh Chowk, Varachha Road, Surat-395006.

Society, Near New Shakti Vijay Society, Varachha Road, Surat-395006 3. Pravinbhai Babubhai Aalagiya, Add : D-1, Sagar Co-op. Housing Society, Opp. Neel Kamal Park, L.H.Road, Surat-395006.

Kalpeshthai Vinubhai Kakadiya, Add : 69, Kasturba Nagar Society, Near New Shakti Vijay Society, Varachha Road, Surat-395006.
 Mahendrabhai Vinubhai Kakadiya, Add : 69, Kasturba Nagar Society, Nagar Society, Varachha Road, Surat-395006.

Krishnaben Rameshbhai Asodariya, Add : Plot No.-167, Mamta Park Society-2, Kapodara, Varachha Road, Surat-395006.
 Himmatbhai Balabhai Devani, Add : C-204, Sukan Residency, Pedar

Road, Mota Varachha, Surat-394101. 3. Rameshbhai Muljibhai Asodariya, Add : Plot No.-167, Mamta Park Society-2, Kapodara, Varachha Road, Surat-395006.

Society-Z, Kapodara, Varachna Road, Surat-395006.

4. Vinubhai Kalyanbhai Kakadiya, Add: 69, Kasturba Nagar Society,
Near New Shakti Vijay Society, Varachha Road, Surat-395006.

5. Pravinbhai Babubhai Aalagiya, Add: D-1, Sagar Co-op. Housing
Society, Opp. Neel Kamal Park, L.H.Road, Surat-395006.

6. Kalpeshbhai Vinubhai Kakadiya, Add: 69, Kasturba Nagar Society,
Near New Shakti Vijay Society, Varachha Road, Surat-395006.

7. Mahendrabhai Vinubhai Kakadiya, Add: 69, Kasturba Nagar Society,
Near New Shakti Vijay Society, Varachha Road, Surat-395006.

DESCRIPTION

OF

PROPERTY

Flat No. 303, Third Floor, "Subham Residency", Revenue Survey No.69/3/B, Block No.94, TPS No.38,

Magob, Surat. Legal Mortgage Residency Property. BUA Area in 1306.03 Sq.Ft (Super Builtup 2016.00 Sq.Ft.) Type of Possession : Physical

Flat No. 304, Third Floor, "Subham Residency", Revenue Survey No.69/3/B, Block No.94, TPS No.38, Magob,Surat. Legal Mortgage Residency Property. BUA Area in 1306.03 Sq.Ft (Super Builtup 2016.00 Sq.Ft.) Type of Possession:

Legal Mortgage of Commercial Shop No.7, Gr.Floor,

Tulsi Arcade, Revenue Survey No.266/2, 267/1, 268/1, Block No.251, TPS No.24, FP No.112, Mota Varachha, Surat. Area in Sq.Mts. 26.86 BUA.

Legal Mortgage of Commercial Shop No.16, Gr.Floor, Tulsi Arcade, Revenue Survey No.266/2, 267/1, 268/1, Block No.251, TPS No.24, FP No.112, Mota Varachha, Surat. Area in Sq.Mts. 17.02 BUA. Type of Possession: Physical

Legal Mortgage of Commercial Shop No.47, Gr.Floor,

Tulsi Arcade, Revenue Survey No.266/2, 267/1, 268/1 Block No.251, TPS No.24, FP No.112, Mota Varachha Surat. Area in Sq.Mts. 21.95 BUA.

Legal Mortgage of Commercial Shop No.48, Gr.Floor, Tulsi Arcade, Revenue Survey No.266/2, 267/1, 268/1 Block No.251, TPS No.24, FP No.112, Mota Varachha

Legal Mortgage of Commercial Shop No.49, Gr.Floor, Tulsi Arcade, Revenue Survey No.266/2, 267/1, 268/1 Block No.251, TPS No.24, FP No.112, Mota Varachha Surat. Area in Sq.Mts. 20.28 BUA.

Legal Mortgage of Commercial Shop No.50, Gr.Floor, Tulsi Arcade, Revenue Survey No.266/2, 267/1, 268/1 Block No.251, TPS No.24, FP No.112, Mota Varachha

Legal Mortgage of Commercial Shop No.347, Third Floor, Tulsi Arcade, Revenue Survey No.266/2, 267/1, 268/1, Block No.251, TPS No.24, FP No.112, Mota Varachha,

Legal Mortgage of Commercial Shop No.348, Third Floor,

Tulsi Arcade, Revenue Survey No.266/2, 267/1, 268/1, Block No.251, TPS No.24, FP No.112, Mota Varachha, Surat. Area in Sq.Mts. 114.53 BUA.

Type of Possession : Physical

Type of Possession : Physical

Surat, Area in Sq.Mts. 21,95 BUA

Type of Possession : Physical

Type of Possession : Physical

Surat. Area in Sq.Mts. 20.28 BUA.

Type of Possession : Physical

Surat. Area in Sq.Mts. 86.97 BUA. Type of Possession : Physical

Type of Possession: Physical

Near New Shakti Vijay Society, Varachha Road, Surat-395006

Near New Shakti Vijay Society, Varachha Road, Surat-395006

Partners:

1. Rameshbhai Muljibhai Asodariya, Add: Plot No.-167,
Mamta Park Society-2, Kapodara, Varachha Road, Surat-395006.

2. Vinubhai Kalyanbhai Kakadiya, Add: 69, Kasturba Nagar

Borrower: M/s. VNR EXPORTS (Partnership Firm)

Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]

Reserves excluding Revaluation Reserves

Earning per Share - Not Annualised (in Rs.)

SHAH METACORP LIMITED (FORMERLY KNOWN AS GYSCOAL ALLOYS LIMITED)

Regd. Office : Plot No. 2/3 GIDC, Ubkhal, Kukarwada, Taluka : Vijapur, Dist. : Mehsana - 382830 Corp. Off. : 2nd Floor, Mrudul Tower, B/h. Times of India, Ashram Road, Ahmedabad - 380 009 Phone : 079-26574878 || Email : info@gyscoal.com || Website : www.gyscoal.com || CIN : L27209GJ1999PLC0366

STATEMENT OF CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE

QUARTER & YEAR ENDED ON 31ST MARCH, 2024 (Rs. in Lacs, Except EPS)

31-03-2024

Audited

4628.26

156.05

156.05

147.89

154.99

0.04 0.04

4193.39

EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2024 (Rs. in Lacs, Except EPS)

Notes: (1) Net profit for the above financial results have been reviewed and considered by the Audit Committee and subsequently approved by the Board of Directors at their respective meetings held on May 21, 2024 (2) These audited financial results have been prepared in accordance with the Indian Accounting Standard as specified as per Companies Act, 2013 read with relevant Rules & other recognized accounting practice and policies to the extent applicable, (3) The above is an extract of detailed format of Standalone and Consolidated financial results filed with the Stock Exchange under Regulation, 33 of SEBI (Listing Obligation and Disclosures Requirement) Regulation, 2015. The detailed Standalone and Consolidated financial results were reviewed by the Board of Directors at their respective meetings held on May 21, 2024 and it is available on the Company's website www.gyscoal.com and on the website of the Stock Exchange at www.bseindia.com & at www.nseindia.com. (4) The consolidated financial results were reviewed by the Board of Directors at their respective meetings held on May 21, 2024 and it is available on the Company's website www.gyscoal.com and on the website of the Stock Exchanges at www.bseindia.com & at www.nseindia.com. (4) The consolidated financial results include the financial result of the associate company viz. Goldman Hotels & Resorts Private Limited and Wholly owned Subsidiary Company Shah Agrocorp Private Limited ("Official Private Limited") with Mis. Omkara ARC? which is a standard to the private Limited ("Official Experiment") and the private Limited ("Official Expe

31-03-2024

Audited

150.32

149.26

Quarter Ended

31-12-2023

Unaudited

1291.09

79.92

79.92

77.11

77.11

0.02

Quarter Ended

31-12-2023

Unaudited

1291.09

79.92

77.11 77.11

For and on behalf of Shah Metacorp Limited (formerly known as Gyscoal Alloys Limited)

sd/- Mona Shah, Director and Chairperson

THE SARVODAYA SAHAKARI BANK LTD.

Reg.Office: "SHRI NIDHI", KHAND BAZAR, VARACHHA ROAD, SURAT- 395006

Ph.No.0261-2554365/66/67

AUCTION OF IMMOVBLE PROPERTY

AUCTION OF ASSETS IN PHYSICAL POSSESSION OF BANK UNDER THE SECURITISATION & RECONSTRUCTION
OF FINANCIAL ASSETS & ENFORCEMENT OF SECURITY INTEREST ACT 2002 AND SECURITY INTEREST
(ENFORCEMENT) RULES-2002. Offers are invited so as to reach the Authorized Officer on or before the

Commencement of auction for the sale of the following properties in the possession of the bank on "As is where is basis, As is what is basis and whatever there is Basis" towards the recovery of its secured Debts with interest, courts charges etc. from borrower as stated here under.

4190.79

31-03-2023

Audited

2068.41

(741.27)

(741.27)

(625.34)

(604.19)

3323.79

(0.18) (0.18)

Audited

2068.7

(741.27)

(625.34)

(604.19)

Secured Debt for Recovery

Contractual Interest and expenses thereon

Contractual Interest and expenses thereor

DATE OF

INSPECTION

TIME OF

INSPECTION

Last Date & Time

for EMD

submission

Dt.19/06/2024

Dt.25/06/2024

up to 4:00 PM

Dt.19/06/2024

12:00 PM to 3:00 PM

Dt 25/06/2024

up to 4:00 PM

12:00 PM to 3:00 PM

Dt.26/06/2024

up to 4:00 PM

Dt.20/06/2024

2:00 PM to 3:00 PM

Dt.26/06/2024

up to 4:00 PM

2:00 PM to 3:00 PM

Dt 26/06/2024

Dt.20/06/2024

2:00 PM to 3:00 PM

Dt.26/06/2024

up to 4:00 PM

Dt.20/06/2024

Dt.26/06/2024

up to 4:00 PM

Dt.20/06/2024

12:00 PM to 3:00 PM

Dt.26/06/2024

up to 4:00 PM

Dt.20/06/2024

12:00 PM to 3:00 PM

Dt.26/06/2024

up to 4:00 PM

Dt.20/06/2024

Dt.26/06/2024

up to 4:00 PM

2:00 PM to 3:00 PM

2:00 PM to 3:00 PM

Dt.20/06/2024

Rs.55,22,000/- Dt.20/06/2024

2:00 PM to 3:00 PM

Reserve Price

EMD

Bid in

multiplication

of

Rs.63,50,000/

Rs.6,35,000/-

Rs.63,50,000/-

Rs.6,35,000/-

Rs.5.52.200/-

Rs.26.37.000/-

Rs.2,63,700/-

Rs.43,79,000/-

Rs.4,37,900/-

Rs.34.88.000/-

Rs.3.48.800/-

Rs.32,00,000/-

Rs.3,20,000/-

Rs 32 00 000/-

Rs.3.20.000/-

Rs.50,000/

Rs.89,28,000/-

Rs.8.92.800/-

Rs.1,16,46,000/-

Rs.11,64,600/-

Rs.50.000/-

Rs.50.000/-

Rs.50.000/-

Rs.50.000/

Rs.50,000/-

Rs.50.000/-

Rs.50.000/-

Rs.50,000/-

Rs.50.000/-

Date of

Auction

Time

Dt.26/06/202

from1:00 PM

onwards

Dt.26/06/202

from1:00 PM

onwards

Dt.27/06/20

from1:00 PM

onwards.

Dt.27/06/202

from1:00 PM

onwards.

Dt.27/06/202

from1:00 PM

onwards

Dt.27/06/202

from1:00 PM

onwards.

Dt.27/06/202

from1:00 PN

onwards

Dt.27/06/202

from1:00 PM

onwards

Dt.27/06/202

from1:00 PM

onwards.

Dt.27/06/202

from1:00 PN

onwards.

Loan A/c No.1006071000010 As per demand notice dtd.16/09/2021 u/s.13(2) for Rs.2,77,82,394.66 as on dt.14/09/2021 together with further

As per demand notice dtd.16/09/2021 u/s.13(2) for Rs.2,57,93,709.00 as on dt.14/09/2021 together with further

till the date of payment

Loan A/c No. 1006071000011

O punjab national bank

पंजाब नैशनल बैंक

GSAD, Circle Office Surat: 4th Floor, Tulsi Krupa Arcade, Parvat Patiya, Surat-39501 PREMISES REQUIRED

Punjab National Bank invites sealed offers for premises in two bid systems for following branch office. The Premises should have commercial approved or a building conforming to the conditions stipulated by concerned Government authority for commercial use. Intersted parties who are ready to lease out their readily available premises on long term lease basis preferably fo 15 years or more, located in locations and locality as follows may bid.

Name of Branch	Dist.	Desired Locality	Approx. Carpet Area Required	
Lalgate	Surat	Lalgate Main Road & area around existing Punjab National Bank, Lalgate Branch	1700 to 2100 sq.ft. including space for ATM	
The premis	The premises should be preferably on Ground Floor with ramp facility and if on first floor, lift			

Facility should be available with all other facility including adequate power, Water supply, Parking space, space for signage board, generator, V-SAT/RFTower at terrace without an yextra charges beyond rent. Date of commencement of Bid download 23.05.2024 from 10.00 hrs, Last date and time for downloading bid 05.06.2024 up to 12.00 hrs. Last Date for Bid Submission 05.06.2024 til

18.00 hrs, Date and Time of Opening Technical cum Eligibility Bid 06.06.2024 from 12.00 hrs (or will be intimated). at address as follows : Chief Manager, GSAD, Punjab Nathinal Bank, Circle Office, Surat, 4th Floor, Tulsi Krupa Arcade, Parvat Patiya, Surat-395010

No brokerage will be paid by the Bank, Bank reserves the right to accept or reject any or all offers at its sole discretion without assigning any reasons whatever

Date: 23.05.2024 CIRCLE HEAD

) बैंक ऑफ़ बड़ौटा Bank of Baroda

Chalthan Branch: Shop No. 1-5 Sai Vatika, Nh 48, Opposite Chowki Dhani Hotel, Palsana, Dist. Surat - 394305 Email : vjchal@bankofbaroda.com, Ph. No. 02622 281101

POSSESSION NOTICE [SECTION 13(4)] (For Immovable property [Under Rule-8(1) of Security Interest (Enforcement) Rules 2002.

Whereas, The undersigned being the authorized officer of the Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interes Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice date 12.03.2024 calling upon the borrower/guarantor Mr. Vijaykumar Jagdish Mehta (Borrower), Mr. Kanubhai Bhagwan Wod (Guarantor) & Mrs. Rita Vijaykumar Mehta (Guarantor) to repay the amount mentioned in the notice being Rs.8,32,056.16/- (Rupees Eight Lakhs Thirty Two Thousand Fifty Six And Sixteen Paise Only) Unapplied interest plus other Charges within 60 days from the date of receipt of the said notice

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this the day of 20" day of May of the year 2024.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of **Bank of Baroda** for an amount of **Rs. 8, 32,056.16**/- Unapplied interest & other Charges. - DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

Equitable Mortgage of Plot No A/450, which is admeasuring about 50.17 Sq. Mtrs situated at Shree Balaji Housing Society, Block no 121, Moje: Kadodara, Sub District: Palsana District: Surat.Boundaries are: East:- Society Road, West:- Plot no B/425, North:-Plotno A/451, South:-Plotno A/449

Date :20/05/2024 Authorised Officer, BANK OF BARODA

🕖 वैंक ऑफ़ बड़ीदा **)** Bank of Baroda

Porbandar (Main) Branch: M. G. Road, Porbandar, Pin - 360 575 (Gujarat). POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, The undersigned being the authorized officer of the Bank Of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement o Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 16.02.2024 calling upon the Borrower Mr. Chirag Kanjibhai Mokariya & Mrs. Urmilaben Kanjibhai Mokariya to repay the amount mentioned in the notice being Rs. 8,22,650.26 (Rs. Eight Lakh Twenty Two Thousand Six Hundred Fifty and Paise Twenty Six only) as on 16.02.2024 together with further interest thereon at the contractual rate plus costs, charges and expenses till date of payment within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of section 13 of the Act read with rule 8 of the Security interest Enforcemen Rules, 2002 on this the 18th day of May 2024.

The Borrower/Guarantor/Mortgagor in particular and the public in general is nereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda, for an amount of Rs. 8,22,650.26 (Rs. Eight Lakh Twenty Two Thousand Six Hundred Fifty and Paise Twenty Six only) and nterest thereon at the contractual rate plus costs, charges and expenses till date of

The Borrower's attention is invited to provision of subsection (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable Property

Immovable Property situated in Chhaya, Taluka and District Porbandar, bearing Chhaya Revenue Survey No. 43/1, Paiki Plot No. 22, Paiki Part No. 22-C, Land admeasuring 48.00 Sq. Mts. and construction thereupon. Bounded as under: North: Adj. Plot No. 22 Paiki Part-22-D

East: 6.00 Mtr. Wide Road West: Adj. Plot No. 23 South: Adj. Plot No. 22 Paiki Part-22-B Date : 18.05.2024

Place : Porbandar

Chief Maganer

Bank of Baroda

HERO HOUSING FINANCE LIMITED

Website: www.herohousingfinance.com | CIN: U65192DL2016PLC30148 Address: Building No. 7, 2nd Floor, Community Center, Basant Lok, Vasa New Delhi- 110057

DEMAND NOTICE

Under Section 13 (2) of the Securitis d Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 ("Act") read with Rule 3 of the Security

Interest (Enforcement) Rules, 2002 ("Rules"). Whereas the undersigned being the Authorised Officer of Hero Housing Finance Limited (HHFL

under the Act and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Rule Iready issued detailed Demand Notices dated below under Section 3(2) of the Act, calling upon the corrower(s)/Co-Borrower(s)/Guarantor(s) (all singularly or together referred to "Obligors")/Lega leir(s)/Legal Representative(s) listed hereunder, to pay the amounts mentioned in the respective Demand Notice/s, within 60 days from the date of the respective Notice/s, as per details given below Copies of the said Notices are served by Registered Post A.D. and are available with the undersigned, and the said Obligor(s)/Legal Heir(s)/Legal Representative(s), may, if they so desire collect the respective copy from the undersigned on any working day during normal office hours.

in connection with the above, Notice is hereby given, once again, to the said Obligor(s) /Lega Heir(s)/Legal Representative(s) to pay to HHFL, within 60 days from the date of the respective Notice/s, the amounts indicated herein below against their respective names, together with further interest as detailed below from the respective dates mentioned below in column (d) till the date of payment and / or realisation, read with the loan agreement and other documents/writings, if any ecuted by the said Obligor(s). As security for due repayment of the loan, the following Secure

.sset(s) have been mortgaged to HHFL by the said Obligor(s) respectively. Total Outstanding Date of Dues (Rs.) as on Legal Heir(s)/Legal Representative(s) below date* Date of NPA Amirullah Khitabullah Chaudhary, Chaudhary Taslimunnisha Amirullah Rs 7 96 159/- as HHFAKWLAP2 21-05-2024 on 21-May-2024 06-05-2024

Description of the Secured Assets/Immovable properties/ mortgaged properties: All that piece and parcels of Immovable Property being Plot No 299, admeasuring 41.91 sq. mlrs. Known as "PRATHISHTHA RESIDENCY" Non-agricultural plot of land in Muje Kapodara, lying being land bearing Revenue Survey. No. 198, admeasuring 26102.00 Sq. Mtrs. paikki at Muje Kapodara, Sub

District-Ankleshwar, District-Bharuch Gujrat. Property Bounded By: East: Society Road, West: Vado North: Plot No 300, South: Plot No 298 HHFSURHOU23000040134 Joshi Rinkuben Vinodray, Rs. 27,99,952/-

as on 21-05-2024 07-05-2024 & HHFSURIPL23000040135 | Joshi Kshamaben Vinodray Description of the Secured Assets/Immovable properties/ mortgaged properties: All that piece and parcels of B-Type, Plot No. 3, admeasuring 674.92 Sq. Ft. i.e. 74.99 Sq. Yard i.e. 62.70 Sq. Mt. along with 35.36 Sq. Mts. ground Adm. 53.88 Sq. Mts., & first floor Adm. 53.88 Total Adm. 98.06 Sq.

construction know as name "SKYLINE VILLA", Situate at Block No. 61 (61/3), admeasuring He Are. 1-35-57 Sq. Mt., of Moje Village Atodara, Taluka: Olpad, District: Surat, Gujrat. Own by, Rinkuber Viondray Joshi. Property Bounded By: North: Block No 62 Open Land, South: 12. Mts. Road, East Plot No. 2. West: Plot No. 4

Krishna Singh Pradeep Singh Rs. 10,67,643/- 21-05-2024 Rathor, Sapna Kishan Singh as on 21-05-2024 07-05-2024 HHESURHOU23000036491 R HHFSURIPL23000036494 Rathor

Description of the Secured Assets/Immovable properties/ mortgaged properties: All that piece and parcels of Land bearing Plot No. 25 according to the passing plan & as per sanction plan Plot n B-25 (as per KJP it was given Block No. 395/25) admeasuring about 39.05 Sq. Mts. (as per Passing plan admeasuring 42.85 Sq. mts.) with undivided proportionate share in Road and COP admeasurin about 20,66 Sq. Mts. total admeasuring about 63,51 sq. mts. building know as name "OM SAI RESIDENCY", Situate at Revenue Survey No.357/1, Block No. 395 (before promulgation it was given old block no 362), admeasuring about 26860 Sq. Mts., of Moje Village- Pipodara, Sub District-Mangrol, District-Surat, Gujrat. Belongs to Sapna Kishan singh Rathor & Krishna singh Pradee singh Rathor. Property Bounded By: East: Adj. Society Boundary, West: Adj. Society Internal Road North: Adj. Plot No 24, South: Adj. Plot No 26

*with further interest, additional Interest at the rate as more particularly stated in respective Deman Notice date

mentioned above, incidental expenses, costs, charges etc incurred till the date of payment and/or realization. If the said Obligor(s) shall fail to make payment to HHFL as aforesaid, then HHFL shall proceed against the above Secured Asset(s)/Immovable Property(ies) under Section 13(4) of the

said Act and the applicable Rules entirely at the risk of the said Obligor(s)/Legal Heir(s)/Legal Representative(s) as to the costs and consequences.

The said Obligor(s)/Legal Heir(s)/Legal Representative(s) are prohibited under the said Act to transfer the aforesaid Secured Asset(s)/Immovable Property, whether by way of sale, lease or otherwise without the prior written consent of HHFL. Any person who contravenes or abets contravention of the provisions of the Act or Rules made thereunder shall be liable for imprisonment and/or penalty as provided under the Act. Sd/- Authorised Office Date: 23-05-2024 Place: Ankleshwar/Surat For Hero Housing Finance Limite

HCL INFOSYSTEMS LIMITED

CIN: L72200DL1986PLC023955

Regd. Off.: 806, Siddharth, 96 Nehru Place, New Delhi 110 019. Corp. Off.: A-11, First Floor, Sector -3 Noida, UP 201301. Phone number: +91 120 2520977, 2526518-19

Website: www.hclinfosystems.in; Email ID: cosec@hcl.com nt of Audited Consolidated Financial Results for the guarter and year ended March 31, 2024

				(Rs. in Lakhs
		Quarter	Quarter	Year	Year
SI	PARTICULARS	ended	ended	ended	ended
No.		31-Mar-24	31-Mar-23	31-Mar-24	31-Mar-23
		(Audited)	(Audited)	(Audited)	(Audited)
1.	Total income from operations	1,497	1,606	6,199	5,480
2.	Net Profit / (Loss) for the period (before tax, Exceptional	(547)	(1,457)	(2,778)	(5,258)
\square'	and/or Extraordinary items) from continuing operations	<u> </u>			
3.	Net Profit / (Loss) for the period before tax (after exceptional	(547)	(560)	(1,582)	(3,874)
	and/or Extraordinary items) from continuing operations	<u> </u>			
4.	Net Profit / (Loss) for the period after tax (after exceptional	(553)	(565)	(1,588)	(3,879)
<u></u> '	and/or Extraordinary items) from continuing operations	<u> </u>			
5.	Net Profit / (Loss) for the period before tax (after exceptional	'	-	-	-
	and/or Extraordinary items) from discontinued operations	<u>'</u>			
6.	Net Profit / (Loss) for the period after tax (after exceptional	'	_	_	_
	and/or Extraordinary items) from discontinued operations,	'	[1
Ш	including disposal	<u> </u>			
7.	, (,	(553)	(565)	(1,588)	(3,879)
Ш	(after exceptional and/or Extraordinary items)	<u> </u>			
8.		(567)	(556)	(1,583)	(3,839)
	Profit / (Loss) for the period (after tax) and other	'			1
\square	comprehensive income (after tax)]	<u> </u>			
9.	Paid up equity share capital	6,584	6,584	6,584	6,584
10.	Reserves (excluding Revaluation Reserve)	'	-	(33,516)	(31,934)
11.					
	discontinued operations) -	<u> </u>			
	Basic :	(0.17)	(0.17)	(0.48)	(1.18)
	Diluted:	(0.17)	(0.17)	(0.48)	(1.18)

The summary of Audited standalone financial results for the relevant periods are as follows

			(Rs. in Lakhs)
		Quarter	Year	Year
PARTICULARS	ended	ended	ended	ended
PARTICULARS	31-Mar-24	31-Mar-23	31-Mar-24	31-Mar-23
	(Audited)	(Audited)	(Audited)	(Audited)
Total income from operations	665	495	1,784	1,975
Net Profit/(Loss) for the period before tax and exceptional items	3	(296)	(1,247)	(2,329)
Net Profit/(Loss) for the period before tax and after exceptional items $\label{eq:loss} % \begin{center} \beg$	(535)	(558)	(1,555)	(3,837)
Profit/(Loss) after tax and after exceptional items	(535)	(558)	(1,555)	(3,837)
Total comprehensive income for the period [comprising Profit/(Loss)	(535)	(556)	(1,555)	(3,835)
for the period (after tax) and other comprehensive income (after tax)]				

Place: Noida

Date: May 22, 2024

吗

3,987.64

(28.76

(28.76

165.38

186.53

0.06

3323.79

-4,728.5

Audited

3,987.63

(28.76)

186.5

31-03-2024 31-03-2023

9676.54

440.48

440.48

426.32

433.42

4193.39

-1,562.84

Audited

434.76

420.59

427.69

Year Ended

31-03-2024 31-03-2023

After recommendation by the Audit Committee, these results have been approved and taken on record by the Board of Directors at its meeting held on May 22, 2024. The results have been subjected to a audited by the statutory auditors, pursuant to Regulation 33 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation 2015.

The above is an extract of the detailed format of Quarterly/Yearly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the consolidated and standalone Quarterly/Yearly Financial Results are available on the Stock Exchange websites (www.nseindia.com) and also available at the company's website www.nseindia.com) and also available at the company's website www.nclinfosystems.in.

Put order of the Roard

By order of the Board for HCL Infosystems Limited

Nikhil Sinha

Date 16/05/2024



Punjab & Sind Bank

Reid Road, Railwaypura, Ahmedabad - 380002 Phone: 079-22145878 E-mail: a0476@psb.co.in

Registered AD

1) Mrs Kaniifatma Abidhusen Momin Hussen, W/o Sh Gulam Abbas Momin

Address 1: 5/1243 Makan Par, Lilajpur, Nr Kevadiya Road, Bhagalpur, Tal, Dholka, Dist-Ahmedabad-387810 Also at: 138 Paiki ,Inside Goodluck Barrel Market No-2, Behind Metro Khursiwala, Chandola, Ahmedabad-380028

REG.:- NOTICE UNDER SECTION 13(2) OF SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 That you addressee No 1 Mrs Kanijfatma Abidhusen Momin, (Borrower) D/o Abidhusen requested the bank for

financial assistance and upon the request, the Bank sanctioned and allowed Term Loan of Rs 19.95 Lakh (Rupees Nineteen Lakh Ninety Five thousand only) and Cash credit limit of Rs 2.00 Lakh (Rupees Two Lakh only) vide MDP No 12/2018-19 sanction dated 30.08.2018 @ 10.70 Percent per annum (1 Yr MCLR 8.70+2.25%-0.25%) The said Term loan and Cash credit facility were duly secured by the security mentioned as under :-

Nature of Credit Facility	Description of Assets		
Term Loan Rs 19.95 Lakh Account No. 02401200000349	Hypothecation of Single Jersey Knitting Machine technical data model (TXS-3F & TXS-4F) worth Rs 21.00 Lakh purchased through Bank finance.		
Cash credit facilty Account No. 02401600003036	Hypothecation of Stocks of Raw materials ie Yarn & Finished goods of knitted yarn & book debt (not older than 90 days)		
3) That you addressee No. 1 has, executed various loan and security documents in respect of the above loan facility or			

03.10.2018 and also agreed to pay the rate @ 10.70 % per annum (1 Yr MCLR 8.70+2.25%-0.25%) with monthly rests and as per guidelines of the Bank from time to time, in respect of the above loan facility Addressee No. 1 created hypothecation charge in respect of movable property mentioned below to secure the dues of

the bank in consideration of the above said loan facilities to addressee No-1

The details of the movable property are as under:-

Hypothicatee: Kanijfatma Abidhusen Momin.

Hypothicator: Puniab & Sind Bank, Bo Reid Road, Ahmedabad

Amount of Assets Hypothected: Rs 21.00 Lakhs

of Section 2(o) of the Act.

Description of Assets: Single Jersey Knitting Machine technical data model (TXS-3F & TXS-4F) worth Rs 21.00 Lakh

Rate of interest: 10.70 Percent per annum (1 Yr MCLR 8.70+2.25%-0.25%)

Present Sum Due: of Rs 20,89,808.28DR. (Twenty lakh Eighty Nine thousand eight hundred eight & paisa twenty eight only) inclusive of interest up to 30/04/2024 and further interest & Charges thereon The said Term loan was repayable in 81 equated monthly installments of Rs 34,691/- w.e.f December 2018 till the date

of payment in full

That you agreed to pay the additional interest at the rate of 2% per annum over and above the normal agreed rate of

interest with monthly rests, in case of default in terms and conditions of the sanction and loan documents.

That you have executed loan documents on 03.10.2018 and revival letter dated 20.08.2021.

That you have failed to comply and breached the terms of sanction and also you have not paid regularly EMI in the said Term Loan Account and hence, the bank has classified your loan account as N.P.A. on 28/12/2021 as per the quideline issued by the Reserve Bank of India and its head office from time to time in this regards, within the definition

That Bank maintains the regular books of Term Loan account vide a/c no. 02401200000349 and now a sum of R 20,89,808.28DR. (Twenty lakh Eighty Nine thousand eight hundred eight and paisa twenty eight only) inclusive o interest up to 30/04/2024 is legally due and recoverable from you above named addressees and you all are jointly and severally liable to pay the above said dues to the bank with interest cost and other usual bank charges till the date of

payment in full. The details are as under:-Sr. No. Nature of Facility Amount Outstanding Rate of Interest

	1	Term Loan	20,89,808.28 DR.	10.90%	
		Total	20,89,808,28 Dr		
e of	interest va	ries from time to time as	per internal guidelines of the b	ank and the present ra	ate o

The rate of interest is 10.90 percent per annum as per the Reserve Bank of India directives. 10. That you have defaulted in the repayment of the dues of the bank which is secured as mentioned above

11. You are also put on notice that in terms of sub section 13 you shall not transfer by sale, lease or otherwise the said secured assets detailed in this notice without obtaining written consent of the Bank

12. Your kind attention is invited to provision of Sub section (8) of section 13 of the SARFAESI Act where under you can tender the entire amount of outstanding dues together with all costs, charges and expenses incurred by the bank only till the date of publication of the notice for sale secured assets by public auction, by inviting quotations tender from public or by private treaty. Please also note that if the entire amount of outstanding dues together with the costs charges and expenses incurred by the bank is not tendered before publication of notice for sale of the secured assets by public auction, by inviting quotations, tender from public or by private treaty, you may not be entitled to redeem the

13.Please also note that this notice is sent to you without prejudice to the other rights and remedies available to the bank including initiation of the appropriate legal proceedings before appropriate Courts and/or Tribunals for recovery of the above said outstanding amounts. This notice is also without prejudice to the Bank's right for undertaking the prosecution of any complaint filed by bank under Section 138 of Negotiable Instrument Act, 1881 as amended and/or Payment of Settlement Act 2007 as amended.

therefore, by virtue of this Demand notice, hereby call upon addressee No.1 Mrs Kaniifatma Abidhusen Momin (Borrower) D/o Abidhusen to make the payment & discharge in full liabilities amounting to Rs 20,89,808.28DR. (Twenty lakh Eighty Nine thousand eight hundred eight and paisa twenty eight only) and further interest & Charges thereon W.E.F. 30/04/2024, to the bank within 60 days from the receipt of this notice, failing which the Bank shall be constrained to take measures under provisions of chapter III of Securitization And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002, for recovery of above secured dues and in that case you will be jointly and severally liable to pay for all costs and other expenses arising there from.

Please note that the copy of this notice has been retained in our office. Yours Sincerely, For Punjab & Sind Bank

(Authorized Officer)

Date: 21/05/2024 Place: Surat

The Sarvodaya Sahakari Bank Ltd.

Place of Auction: Board Room, The Sarvodaya Sahakari Bank Ltd., "Shri Nidhi", Khandbazar, Varachha Road, Surat. The Bidder shall give offer for above properties with the EMD amount (Earnest Money Deposit) by

neans of Demand Draft/ Pay Order drawn in favour of "The Sarvodaya Sahakari Bank Ltd." payable at Sural Payment by any other mode (i.e. Cheque/Cash/RTGS/NEFT etc.) will not be considered as EMD. If the Bid is not accepted, the amount of EMD will be refunded without interest. Bidder may remain present and revise r upwards. On the confirmation of the Bid, the successful highest Bidder to deposit 25% of the accepted bidding amount on the day of auction and the balance 75 % of amount within 15 days, failing which the bank will forfeit the entire amount already paid by the Bidder without any notice.

Any pending statutory dues, Government dues, Sales tax, Income tax, Vat dues, Commercial Tax dues, G.S.T., Excise dues, Semi Govt. Dues, Labour dues, Provident Fund, Surat Municipal Corporation Tax, Taluka Gram Panchayat dues / Property tax, Electricity Bill, Maintenance and any other dues payable on above auctionable property along with expenses for transfer, shall have to be borne by the Purchaser. Any other dues liabilIties/ charge other than this, bank not known to the bank shall be paid and cleared by the purchaser. Any other dues/liabillties/ charge other than this bank, not known to bank shall be paid and cleared by the purchase The cost, expenses stamp duty, additional stamp duty, registration charges incurred for the purpose of transfe of said property shall be borne by the purchaser. The purchaser shall get property transferred of its own and get the sale certificate registered before the sub Registrar office in time. If Disturbed Area Act 1991 is applicable to Auctionable property then the purchaser has to obtain of its own NOC from the appropriate authority. The purchaser should also deposit TDS as applicable as per Income Tax Act in Income Tax Department and submit TDS Challans in the name of the owner of the property, in our bank. Bank shall deliver the available title

document of property to purchaser on "As is where is basis, As is what is basis and whatever there is Basis only. The bank has not appointed or enganged any agent and/or broker for sale of the above mortgage property. For further inquiries contact Authorized officer Shri Jitendra B. Patel (Phone no.0261-2554365/66/67 Forms and conditions of sale can be obtained from the Authorized Officer. The Authorized officer reserves its rights to reject or cancel any or all the offers received without giving

any reasons and to postpone the auction at any time Sd/- Chief Manager & Authorized Officer

ભાજપ-કોંગ્રેસને ચૂંટણી પંચે આપી ચેતવણી

સ્ટાર પ્રચારોને ધાર્મિક-સાંપ્રદાયિક આધાર પર ચૂંટણી પ્રચાર નહીં કરવાના નિર્દેશ

તેના નિવેદનો આપી દેતા હોય નહીં. છે. રાજકીય હિત સાધવા માટે ઘણી વાર મર્યાદા ઓળંગી જતાં હોય છે. તેને લઈને ચૂંટશી પંચે કડકાઈ દેખાડી છે. જાતિ, ભાષા, ધર્મ, સેના અને સંવિધાન પર નિવેદન આપવાના મામલામાં ભાજપ અને કોંગ્રેસને ચેતવણી આપી છે. ભાજપ અને

પાર્ટી અને તેના સ્ટાર પ્રચારોને લગાવી શકે છે. ધાર્મિક અને સાંપ્રદાયિક આધાર નિર્દેશ આપ્યા છે. કોંગ્રેસને પણ કરો. કહ્યું છે કે તેમના નેચા એવા

પ્રત્યારોપની જંગમાં મનફાવે સ્ટાર પ્રચારકો આપી શકશે સ્થિતિ ઊભી થાય.

કોંગ્રેસને પણ કહ્યું છે કે તેમના નેતા એવા નિવેદન ન આપે, જેનાથી ખોટી ધારણા બને કે ભારતના સંવિધાનને ખતમ કરવામાં આવી શકે છે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જન કોંગ્રેસ અધ્યક્ષને મર્યાદા બનાવી ખડગેને ચૂંટણી પંચે કહ્યું કે, રાખવા માટે ઔપચારિક નોટિસ ડિફેન્સ ફોર્સેસને સ્ટાર કેંપેનરોના જાહેર કરીને નિર્દેશ આપી દીધા પાયાવિહોણા નિવેદન દ્વારા બદનામ ન કરવા જોઈએ. જો ચૂંટશી પંચે ભારતીય જનતા આવું થશે તો પંચ પ્રતિબંધો

સુરક્ષા દળોને સામાજિક નિવેદન ન આપે, જેનાથી ખોટી આર્થિક સંયોજનને લઈને ધારણા બને કે ભારતના વિભાજનકારી નિવેદન ન આપે. સંવિધાનને ખતમ કરવામાં આ નિર્દેશ અગ્નિવીરયોજનાને

નવી દિલ્હી, તા.૨૨ તરફથી સમાજના ભાગલા આપવામાં આવી ૨હેલા રાજકીય પાર્ટી ચૂંટણીમાં પાડતા કોઈ નિવેદન ન આપવા. નિવેદનો પર આવ્યું છે. આયોગે જનતાને પોતાના પક્ષમાં ખેંચવા અન્યથા આયોગ પ્રચાર કરવા કહ્યું કે, ભાજપ અને તેના સ્ટાર માટે અવનવી તરકીબો પર પ્રતિબંધ લગાવી દેશે. ધર્મ પ્રચારક આવા નિવેદન ન આપે. અપનાવતા હોય છે. આરોપ- સાથે જોડાયેલ વિવાદિત નિવેદન જેનાથી સમાજમાં વિભાજનની



મહારાષ્ટ્રના પૂણે જિલ્લાનાં કલાશી ગામ નજીક ઉજાની ડેમમાં એક બોટ પલટી જતાં છ લોકોના ડૂબી જવાથી મોત થયાની આશંકા વચ્ચે તેમને શોધવા બચાવ રાહત કામગીરી હાથ

અરવિંદ કેજરીવાલને મૂંઝવણમાં

મૂક્યા છે. અને આ મૂંઝવણનું મુખ્ય

કારણ તેના સહયોગી અને નજીકના

મિત્ર વિભવ કુમારની ધરપકડ છે.

સ્વાતિ માલીવાલે વિભવ કુમાર પર

મુખ્યમંત્રી આવાસ પર મારપીટ

કરવાનો આરોપ લગાવ્યો છે.

અરવિંદ કેજરીવાલ માટે સ્વાતિ

માલીવાલ પણ મહત્વની રહી છે,

પરંતુ વિભવ કુમારનું મહત્વ એ પશ

સમજી શકાય છે કે જેલમાં ગયા બાદ

જેલ પ્રશાસનને મુલાકાત માટે

આપવામાં આવેલી યાદીમાં તેમનું

નામ પણ સામેલ હતું.

સ્વાતિ માલીવાલને લઈને કેજરીવાલે તોડ્યું મૌન

આ અંગે પીસીઆરને ફોન કર્યો

હતો. જો કે ૧૩ મેના રોજ કોઈ

બે દિવસ પછી પોલીસે તેનું

માલીવાલ કેસે

અચાનક

કેજરીવાલને

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કુમારે તેને માર માર્યો હતો. તેણે કેજરીવાલે આમ આદમી પાર્ટી (AAP) રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલના આરોપો પર પ્રતિક્રિયા લેખિત ફરિયાદ આપવામાં આવી આપી છે. તેણે ન્યૂઝ એજન્સી નહતી. પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં ચૂંટણી પંચે કોંગ્રેસને કહ્યું કે, કહ્યું, "હું આ કેસમાં નિષ્પક્ષ તપાસ પર ચૂંટણી પ્રચાર નહીં કરવાના રક્ષા દળોનું રાજનીતિકરણ ન અને ન્યાય ઈચ્છું છું. આ કેસમાં બે

વર્ઝન છે. દિલ્હી મહિલા આયોગ (DCW)ના ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ ૧૩ મેના રોજ સીએમ અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને ગયા હતા. આ દરમિયાન તેણે દાવો આવી શકે છે. સ્ટાર પ્રચારકો લઈને સતત કોંગ્રેસ તરફથી કર્યો હતો કેસીએમના પીએ વિભવ

મુંઝવણમાં મૂક્યા નિવેદન નોંધ્યું અને તેના આધારે એફઆઈઆર નોંધવામાં આવી. ત્યારબાદ પોલીસે વિભવ કુમારની ધરપકડ કરી હતી. આમ આદમી પાર્ટી (AAP) દાવો કરે છે કે સ્વાતિ માલીવાલ ભાજપના ષડયંત્રના પ્યાદા છે. માલીવાલનો ઈરાદો અરવિંદ કેજરીવાલને ખોટા

મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વિભવ કુમારની ધરપકડ પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજપ અમારા તમામ નેતાઓને જેલમાં મોકલવા માંગે છે જેથી કરીને તેઓ આમ આદમી પાર્ટી (AAP)ને ખતમ કરી શકે.

આરોપોમાં ફસાવવાનો હતો.

તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે ૧૦ મેના રોજ વચગાળાના જામીન આપ્યા હતા. ત્યારથી ભાજપ પર સતત પ્રહારો થઈ રહ્યા છે. તેણે ૨ જૂને આત્મસમર્પણ કરવું પડશે.

એક ટ્રેન કોચમાં કેજરીવાલને દિલ્હી મેટ્રો સ્ટેશનો અને જ ભણેલો-ગણેલો છે અને એક લઈને અંગ્રેજીમાં ધમકી ટ્રેનની અંદર મુખ્યમંત્રી અરવિંદ જાણીતી બેક્રમાં કામ કરે છે. તે આપનારા સંદેશ લખવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીએ આ મામલામાં પ્રેસ

કોન્ફરન્સ કરીને BJP અને સ્થિતિ હાલ ઠીક નથી. જોકે PMO પર કેજરીવાની હત્યાનું મેડિકલ પછી આ અંગેની પુષ્ટિ ષડયંત્ર રચવા અંગેનો આરોપ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે લગાવ્યો હતો. ૧૯ મેના રોજ પટેલ નગર અને

મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પલટાવ્યો ૮ આરોપીઓના જામીન રદ્દ કરાયા પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના સભ્યોને સુપ્રીમ કોર્ટ તરફથી આજે PFIને સુપ્રીમ કોર્ટનો ઝટકો

બુધવારે મોટો ઝટકો લાગ્યો છે. ઘટનાઓનું ષડયંત્ર રચવાનો સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના આરોપ લગાવવામાં આવ્યો છે અને નિર્જાયને પલટી નાખ્યો છે અને કેસ ચાલી રહ્યો છે. તમામ ૮ આરોપીઓના જામીન રદ્દ

આ આઠ લોકો પર આતંકવાદી ગયા વર્ષે આં૮ આરોપીઓને જામીન આપ્યા હતા. જે બાદ આરોપીઓને જામીન મળવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલે કોર્ટમાં સુનાવણી થઈ અને જસ્ટિસ ત્રિવેદીએ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.

1.562.84

આર.સી નં. ૪૧/૨૦૨૦

ઓ.એ. નં. ૩७૯/૨૦૧૯

-4.728.5

SHAH METACORP LIMITED (FORMERLY KNOWN AS GYSCOAL ALLOYS LIMITED) Regd. Office: Plot No. 2/3 GIDC, Ubkhal, Kukarwada, Taluka: Vijapur, Dist.: Mehsana-382830 Corp. Off.: 2nd Floor, Mrudul Tower, B/h. Times of India, Ashram Road, Ahmedabad-380 009 Phone: 079-26574878 || Email: info@gyscoal.com || Website: www.gyscoal.com || CIN:L27209GJ1999PLC036656

STATEMENT OF CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER & YEAR ENDED ON 31ST MARCH, 2024 31-03-2024 31-03-2023 31-03-2024 31-12-2023 31-03-2023 Audited Audited Total Income From Operation Net Profit / (Loss) for the period (before tax and exceptional items) Net Profit / (Loss) for the period before Tax 4628.26 1291.09 9676.54 (741.27)440.48 440.48 Net Profit for the period after tax (after Exceptional items) Total Comprehensive Income for the period (Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)) Paid up Equity Share Capital (Face Value of Rs.1/- each) (604.19) 3323.79 154.99 433.42 186.53

4193.39

0.04

EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2024 (Rs. in Lacs, Except EPS)

		Quarter Ended			Year Ended	
Sr.		31-03-2024	31-12-2023	31-03-2023	31-03-2024	31-03-2023
No		Audited	Unaudited	Audited	Audited	Audited
1 2 3	Total Income From Operations	4138.94	1291.09	2068.71	9187.22	3,987.63
	Net Profit / (Loss) before tax	150.32	79.92	(741.27)	434.76	(28.76)
	Net Profit / (Loss) after tax	142.16	77.11	(625.34)	420.59	165.37
4		149.26	77.11	(604.19)	427.69	186.52

Notes: (1) Net profit for the above financial results have been reviewed and considered by the Audit Committee and subsequently approved by the Board of Directors at their respective meetings held on May 21, 2024 (2) These audited financial results have been prepared in accordance with the Indian Accounting Standard as specified as per Companies Act, 2013 read with relevant Rules & other recognized accounting practice and policies to the extent applicable.(3) The above is an extract of detailed format of Standarlone and Consolidated financial results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligation and Disclosures Requirement) Regulation, 2015. The detailed Standalone and Consolidated financial results ever reviewed by the Audit Committee and subsequently approved by the Board of Directors at their respective meetings held on May 21, 2024 and it is available on the Company's website wave, wyscoal.com and on the website of the Stock Exchanges at www. besindia.com & at www.nselndia.com (4) The consolidated financial results include the financial result of the associate company viz. Goldman Hotels & Resorts Private Limited and Wholly owned Subsidiary Company Shah Agrocorp Private Limited. (5) The figures for the corresponding previous period have been regrouped reclassified wherever necessive, to make them comparable. (6) The respective investor complaints received and resolved during the quarter as on 31st March, 2024 is Nii. (7) The company had entered into a One Time Settlement ("OTS") with Mis. Omkara Asset Reconstruction Private Limited ("OTS") with Mis. Omkara Asset Reconstruction Private Limited eleter dated 20, 05. 2022 for the tellement of dues of UCO Bank. As per the terms of the OTS, the entire dues of Rs.1,775 Lakhs were to be paid by 25.09.2022 in settlement of principal amount of Rs.3049.89 Lakhs and interest thereon of Rs.1623.31 Lakhs due to UCO Bank. As per the terms agreed, in case of default the company is liable to pay interest at the rate of 24% p.a. compande month For and on behalf of Shah Metacorp Limited (formerly known as Gyscoal Alloys Limited) sd/- **Mona Shah,** Director and Chairperson Place : Ahmedabad Date : 21/05/2024

મુખ્યમંત્રી કેજરીવાલને ધમકી આપવાનો મામલો

દિલ્હી મેટ્રોમાં કેજરીવાલને ધમકી આપતા મેસેજ લખનાર યુવકની ધરપકડ

કેજરીવાલને મારી નાંખવાની રાજકીય પાર્ટી સાથે જોડાયેલો ધમકી આપતા મેસેજ લખનાર નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા યુવકની ધરપકડ કરવામાં આવી મુજબ આરોપીની માનસિક પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીની માનસિક સ્થિતિ હાલ

ઠીક નથી : જોકે મેડિકલ પછી આ અંગેની પુષ્ટિ થઈ શકે છે

ધમકી ભરેલા મેસેજલખનાર આરોપીના સીસીટીવી ફુટેજ એક મીડિયા ચેનલની પાસે ઉપલબ્ધ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીનું નામ અંકિત ગોયલ છે અને બરેલીનો રહેવાસી છે. તે બરેલીથી ગ્રેટર નોઈડા મકાનનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યો હતો.

અંકિત અહીં એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયો હતો અને દિલ્હી ક્ષમેટ્રોમાં સફર દરમિયાન તેણે કેજરીવાલના નામના ધમકી

નકલી માર્કશીટનાં આધારે કર્ણાટકમાં સફાઈ કર્મચારી પટ્ટાવાળો બન્યો

બેંગલુરુ, તા.૨૨ કર્ણાટકમાં એક જોરદાર કિસ્સો સામે આવ્યો છે. કોપ્પલ કોર્ટનાં જજે પટ્ટાવાળાની વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. જજે જ્યારે પટ્ટાવાળાની ધો. ૧૦ની ૯૯ ટકાની ડિગ્રી જોઈ તો તે હેરાન થઈ ગયા કારણ કે સફાઈ કર્મચારી વાંચવા અને લખવામાં સક્ષમ નહોતો. જજે પટ્ટાવાળાની ધો.૧૦ની માર્કશીટ પર શંકા વ્યક્ત કરતા તપાસના આદેશ આપ્યા છે.

૨૩ વર્ષનાં પ્રભુ લક્ષ્મીકાંત લોકરે કોપ્પલ કોર્ટમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા હતા. જોકે તેમણે ધો.૧૦માં ૯૯.૫ ટકા મેળવ્યા હતા અને બાદમાં કોર્ટમાં પટ્ટાવાળાની નોકરી પ્રાપ્ત કરી હતી. જોકે તેમની ઉપલબ્ધિએ જજના મનમાં શંકા પેદા કરી હતી. કારણ કે તેઓ કન્નડ ભાષામાં લખવામાં અને ભણવામાં સક્ષમ નહોતા. તે પછીથી કોપ્પલમાં જેએમએફસી ન્યાયાધીશે પોલીસને તેમની શૈક્ષણિક યોગ્યતા તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે. ૨૬ એપ્રિલે પ્રભુની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.

આધાર હાઉસિંગ ફાયનાન્સ લી.

કોર્પોરેટ ઓફીસઃ યુનિટ નં. ૮૦૨, નટરાજ રૂસતમજી, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને એમ.વી. રોડ, અંધેરી(પૂર્વ), મુંબઈ-૪૦૦૦૬૯ અમદાવાદ શાખાઃ ૩૦૧,ત્રીજા માળે, એબીસી-૩, હોટેલ રીજેંટા સામે, ગિરીશ કોલર્ડ્રિક પાસે, ઉમાશંકર જોશી માર્ગ, ઑફ સી.જી.રોડ, અમદાવાદ-

મહેસાણા શાખાઃ ઓફીસ નં. ૩૦૫, ૩જા માળે, રાજકમલ સીટી મોલ, રાજકમલ પેટ્રોલ પંપ પાસે, સ્ટેટ હાઇવે, મહેસાણા-૩૮૪૦૦૨ (જીજે)

અમદાવાદ ચાંદખેડા શાખાઃ ઓફીસ નં. ૧૯, ૪થો માળ, નક્ષત્ર, મણિપ્રભુ સ્કૂલ સામે, આઈઑસી રોડ, ચાંદખેડા, અમદાવાદ-૩૮૨૪૨૪ (જીજે)

પરિશિષ્ટ ૪ કબજાની નોટીસ (સ્થાવર મિલકત માટે)

અહી નીચે સહી કરનાર સિક્યુરાઇટેઝેશન એન્ડ રિકન્સટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ આધાર હાઉસીંગ ફાયનાન્સ લીમીટેડ (એએચએફએલ)ના અધિકૃત અધિકારી હોવાથી અને સિક્યુરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ના નિયમ ૩ સાથે વંચાણે લેતા ઉક્ત એક્ટની કલમ ૧૩(૧૨) હેઠળ આપવામાં આવેલી સત્તાનો અમલ કરતા, અહી નીચે જણાવેલ કરજદાર(રો)/સહ-કરજદાર(રો)/જામીનદાર(રો)ને અધિકૃત અધિકારી દ્વારા ડીમાંડ નોટીસ આપવામાં આવી હતી અને આ નોટીસમાં જણાવેલી રકમ કથિત નોટીસની પ્રાપ્તિની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવી આપવાની સુચના આપવામાં આવી હતી ઉધારકર્તા ૨કમ ચુકવવામાં નિષ્ફળ ગયા હોવાથી, આ દ્વારા કરજદાર(રો)/ જામીનદાર(રો)ને તથા સામાન્ય જનતાને નોટીસ આપવામાં આવે છે કે સિક્યુરીટી ઇન્ટરેસ્ટ (એન્ફ્રોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ના નિયમ ૮ સાથે વંચાણે લેતા કથિત એક્ટની ક્લમ ૧૩ની પેટા-કલમ (૪) હેઠળ આપવામાં આવેલી સત્તાની રુએ અહી નીચે સહી કરનાર અધિકારીએ, નીચે વર્ણન કર્યા મુજબની મિલકતનો કબજો ધારણ કરેલ છે જામીનકૃત મિલકતને પુનઃપ્રાપ્ત કરવા માટે પ્રાપ્ય સમયના સંદર્ભમાં કથિત એક્ટની કલમ ૧૩ની પેટાક્લમ (૮)ની જોગવાઈઓ પ્રત્યે કરજદારો નું ધ્યાન દોરવામાં આવે છે . વિશિષ્ટ રૂપે કરજદારને અને સામાન્યરીતે જાહેર જનતાને આ મિલકત અંગે કોઈ વ્યવહાર નહી કરવા આથી સુચના આપવામાં આવે છે અને મિલકત અંગેનો કોઈપણ વ્યવહાર, અહી નીચે જણાવેલી રકમ અને તેની ઉપરના વ્યાજ સાથેની રકમ માટે. એએચએફએલના પ્રભારને આધીન રહેશે.

મ	કરજદાર(રો)/ સહ- કરજદાર(રો)/ના નામ (શાખાનું નામ)	જામીનગીરી કૃત મિલકતનું વર્ણન (સ્થાવર મિલકત)	ડીમાંડ નોટીસની તારીખ અને ૨કમ	કબજાની તારીખ
	(લોન કોડ નં. ૦૩૫૦૦૦૦૨૨૩/ અમદાવાદ શાખા) ગુલાબર્સિહ ભાવજી મકવાણા (કરજદાર) કનકબેન ગુલાબર્સિહ મકવાણા (સહ-કરજદાર)	સીટી સર્વે નં. ૮૧ મકાન નં. ૧ સીટી ટીકા નં. ૯ ૪ નવાપુરા સેફાલી સીનેમાં પાસે કડી, મહેસાથા, ગુજરાત-૩૮૨૭૧૫ની સુવાંગ મિલકત. ચતુર્દિશાઃ પૂર્વઃ સદર મિલકતનું બારણું, પશ્ચિમઃ સદર મિલકતનો પાછળનો ભાગ, ઉત્તરઃ અશોકભાઇ રામણીકભાઈ ઉપાધ્યાયની મિલકત સાથે કોમન બાઉડરી, દક્ષિણઃ ગિરીશકુમાર ચંદુ પટેલની મિલકત સાથે કોનામ બાઉડરી.	૧૧-૦૮-૨૦૨૩ રૂા. ૨,૮૭,૫૨૯/-	૨૧.૦૫. ૨૦૨૪
	(લોન કોડ નં. ૨૯૬૧૦૦૦૦૨૨૬/ મહેસાણા શાખા) વિજયકુમાર રાજકુમાર ગૌતમ (કરજદાર) પુષ્પાબેન વિજયકુમાર ગૌતમ (સહ-કરજદાર)	ગ્રાઉંડ ક્લોર બ્લોક નં. ૧૨૩, મિલકત નં. ૧૫/૧/૩૦૩/ ૧૨૩ શ્રીજી હોમ્સ રેસીડેન્સી ઉચરપી રોડ ૧૫ પ્લોટ નં. ૯૦ પી પશ્ચિમ બાજુ મહેસાણા ગુજરાત-૩૮૪૦૦૧ની સુવાંગ મિલકત. ચતુર્દિશાઃ પૂર્વઃ શ્રીજી હોમ્સ સ્કીમ બ્લોક નં. ૧૨૨ની લાગુ જમીન, પશ્ચિમઃ શ્રીજી હોમ્સ સ્કીમ બ્લોક નં. ૧૨૪ની લાગુ જમીન, ઉત્તરઃ આંતરિક રસ્તો, દક્ષિણઃ શ્રીજી હોમ્સ સ્કીમ બ્લોક નં. ૧૩૮ની જમીન,	૧ <u>૩-૧૧-૨૦૨૩</u> ફા. ૯,૪૭,૫૪૮/-	૨૧.૦૫. ૨૦૨૪
	(લોન કોડ નં. ૦૩૫૦૦૦૦૦ ર.૩/ અમદાવાદ શાખા) સુરેશભાઇ લક્ષ્મણભાઇ રબારી (કરજદાર) લક્ષ્મણભાઇ જીવરાજભાઈ દેસાઇ (સહ-કરજદાર) બેચરભાઈ ગોબરભાઈ રબારી (જામીનદાર)	મિલકત નં. ૮૪ રબારી વાસ પ્રાથમિક શાળા પાસે મોજે ભચડીયા દાંતા, બનાસકાંઠા, ગુજરાત, ૩૮૫૧૨૦ની સુવાંગ મિલકત. ચતુર્દિશાઃ પૂર્વઃ ખુલ્લી જમીન, પશ્ચિમઃ નગાજી લક્ષ્મણભાઇ રબારીની મિલકત, ઉત્તરઃ ખુલ્લી જગ્યા, દક્ષિણ:લક્ષ્મણભાઇ જીવરાજભાઈ રબારીની મિલકત.	૧૦-૧૨-૨૦૨૩ ફા. ૫,૦૫,૩૫૫/-	૨૧.૦૫. ૨૦૨૪
	(લોન કોડ નં. ૦૩૫૦૦૦૦૦ ૧૫૭/ અમદાવાદ શાખા) મેહુલકુમાર ગણેશભાઈ ચૌધરી (કરજદાર) ડાડીબેન ગણેશભાઈ ચૌધરી (સહ-કરજદાર) ડાહ્યાભાઇ જહાભાઈ ચૌધરી (જામીનદાર)	મિલકત નં. ૧ પગ્ર નાયી વાસ ડેરી પાસે, મોજે રાજપુરવાડ તાલુકા વડનગર, મહેસાણા, ગુજરાત, ગુ૮૪૩૫પની સુવાંગ મિલકત. ચતુર્દિશાઃ પૂર્વઃ ડાહ્યાભાઈ જનાભાઈ ચૌધરીની મિલકત, પશ્ચિમઃ રામજીભાઈ ડાહ્યાભાઈ ચૌધરીની મિલકત, ઉત્તરઃ રસ્તો, દક્ષિણઃ ડાહ્યાભાઈ દરસંગભાઈ ચૌધરીની મિલકત.	૧ <u>૦-૧૨-૨૦૨૩</u> ફા. ૫,૩૦,૯૪૩/-	ર૧.૦૫. ૨૦૨૪
ı	(લોન કોડ નં. ૨૯૪૧૦૦૦૦૧૩૫/ અમદાવાદ ચાંદખેડા શાખા) વિષ્ણુ જીવાભાઈ પરમાર (કરજદાર) રેશમાબેન વિષ્ણુભાઈ પરમાર (સહ-કરજદાર)	જીએક અને એકએક (એસીસી શીટ) મિલકત નં ૨૩૯, પરમાર વાસ બહુચર માતા મંદિર મહેસાણા ગુજરાત ૩૮૨૭૦પની સુવાંગ મિલકત. ચતુર્દિશાઃ પૂર્વઃ રસ્તો, પશ્ચિમઃ રબારીવાસ, ઉત્તરઃ રસ્તો, દક્ષિણઃ પરમાર અચિનભાઈનું મકાન.	१०-१२-२०२३ इा. ४,२२, <i>६६७</i> /-	ર૧.૦૫. ૨૦૨૪

ૠણ વસૂલી અધિકરણ-૧

Reserves excluding Revaluation Reserves Earning per Share - Not Annualised (in Rs.)

નાણાં મંત્રાલય, નાણાકિય સેવા વિભાગ, ભારત સરકાર ચોથા માળે, ભિખુભાઈ ચેમ્બર્સ, કોચરબ આશ્રમ પાસે, એલીસબ્રીજ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૬

ફોર્મ નં. ૨૨ (અગાઉ ૬૨) (રેગ્યુલેશન ૩७(૧) ડીઆરટી રેગ્યુલેશન, ૨૦૧૫) આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ના બીજા શેડ્યૂલના નિયમો ૫૨(૧) જુઓ.

ઈ-હરાજી-વેચાણ નોટીસ રજી.એડી / દસ્તી / જોડાણ / ઢોલના અવાજ દ્વારા

રીકવરી ઓફ ડેટ્સ ક્યુ ટુ બેંક એન્ડ ફાયનાન્સિયલ એક્ટ ૧૯૯૩ને વંચાણમાં લઈ આવકવેરા ધારા ૧૯૬૧ના બીજા શિક્યુલના રૂલ્સ ૩૮, ૫૨(૨) હેઠળ વેચાણનું જાહેરનામું

સર્ટીફીકેટ ધારકઃ પંજાબ નેશનલ બેંક

સર્ટિફિકેટ દેવાદારઃ નીતીનભાઈ ઘનશ્યામભાઈ મહેતા અને અન્યો

સી.પ્રે.નં. ૧: નીતીનભાઈ ઘનશ્યામભાઈ મહેતા

સી.ડી.નં. ૨: સાવન નીતીનભાઈ મહેતા સી.કી.નં. ૧ અને ૨ ના સરનામા: એ/૩૩, ખોડીયાર કૃપા, C/o. ઈન્ડીયા કોલોની, મેઈન રોડ સામે, બાલેશ્વર ગોલ્ડ પાસે, અમદાવાદ-૩૮૦૦૫૮. **તે ઉપરાંત** ઘર નં. ૩બી, શ્રી બાલાજી હેરીટેજ વીલા, એસ.જી. હાઈવે, અમદાવાદ. **તે ઉપરાંત** બી-૫૦૭/એ, પાંચમા માળે, મોન્ડીયલ સ્ક્વેર, વેજલપુર, અમદાવાદ.

નામદાર પ્રિસાઈ ર્ડીંગ અધિકારી ડીઆરટી - ૧ તરફથી જારી કરવામાં આવેલા વસલાત પ્રમાણપત્ર અનુસાર **નીતીનભાઈ ઘનશ્યામભાઈ મહેતા અને અન્યો** ને **રૂા. ૪૦,૩૫,૯૫૩.૫૪ (રૂપિયા ચાલીસ લાખ પાંત્રીસ હજાર નવસો ત્રેપન અને ચોપ્પન પૈસા પુરા)** (બાદ વર્તમાન પુન:પ્રાપ્તિની કાર્યવાહી દરમ્યાન પ્રાપ્ત થયેલ ૨કમ) ઉપરાંત ચૂંકવવાપાત્ર વ્યાજ અને ખર્ચની વસુલાત માટે નીચે દર્શાવેલી મિલકત **તારીખ ૧૨ જુલાઈ, ૨૦૨૪ના રોજ જાહેર ઈ-હરાજી દારા વેચાણ કરવામાં આવશે**.

	મિલકતનું વર્ણન				
લોટ નં.	સહમાલિકોના નામ સાથે વેચાણ કરવાની મિલકતનું વર્ણન કે જેમાં મિલકત દેવાદારની માલિકીની છે અને અન્ય કોઈ વ્યક્તિ સહ-માલિક તરીકે છે.	અનામત કિંમત જેનાથી ઓછી કિંમતે મિલકત વેચાશે નહી.	અનામત કિંમતના ૧૦% ઈએમડી કે રાઉન્ડેડ સ્કમ		
٩.	મિલકતના એક માત્ર માલિક ના તમામ ભાગ, હક્ક, હીસ્સા, પેટા પ્લોટ નં. ૯૦ (પ્લાન મુજબ ઘર નં. ડી-૪) જમીન ક્ષેત્રકળ ૧૧૧.૦૦ ચો.વાર એટલે કે ૮૩.૬૧.૨૦ ચો.મી. સાથે ચાઉન્ડ ફ્લોર અને પહેલા માળનું બાંધકામ સાથે સરખા ભાગની અવિભાજીત સોસાયટીની જમીન સાથે કોમન એમેનીટીઝની વપરાશ હક્ક સાથે, રૂપીકેશ ધામ - ૨, રૂપીકેશ કો.ઓપ.હા.સો.લી., વિભાગ-૨, સર્વે નં. ૧૨૦૫ પૈકી ૧ જમીન ક્ષેત્રફળ ૭૪૮૨.૦૦ ચો.મી. સીટી સર્વે નં. ૩૧૨૫ (૪૭/૮૩) પૈકી મૌજે (સીમ) સાહંદ, તાલુકા: સાહંદ, રજી. જીલ્લો અમદાવાદ, પેટા-જીલ્લો સાહંદ, જીલ્લો અમદાવાદ.	ર્દા. ૨૮,૮૧,૦૦૦/−	રા. ૨,૮૮,૧૦૦/-		

મિલકત કે તેના કોઇપણ ભાગ માટે આકારેલ કર: જાણમાં નથી

કોઈ કરજનો બોજની વિગતો કે જે અદ્ય કરવા મિલકત જવાબદાર છે.: જાણમાં નથ આકારણી તેમજ સર્ટિફ્રીકેટ દેવાદાર તરીકે જો કોઈ આકારણી આપવામાં આવી હોય તો તે જણાવો. : નથી

જો મિલકત પર કોઈ ઘવો કરવામાં આવ્યો હોય તેની વિગતો અને તેના સ્વરૂપ અને મુલ્ય પર અસરકર્તા અન્ય કોઈ જાણીતી વિગતો: જાણમાં નથી

હરાજી[બિડિંગ (બોલી) ઈ-હરાજી વેબસાઈટ એટલે કે https://www.mstcecommerce.com દ્વારા માત્ર ઓનલાઈન ઈલેક્ટ્રોનીક માધ્યમથી જ થશે. ઈચ્છિત બોલીઘરોએ (બિડર્સ) સર્વિસ પ્રોવાઈડર સાથે તેમની સામેલગીરી અગાઉ રજીસ્ટર કરાવીને ઈ-હરાજીમાં ભાગ લેવા માટે યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લેવાનો રહેશે. નીચે દર્શાવેલ નિયત મોડમાં જરૂરી અર્નેસ્ટમની (બાનાની ૨કમના નાણા) જમા કરાવ્યા બાદ જ તે મેળવી શકાશે.

ઈ-હરાજીની વેબસાટઈટ એટલે કે https://www.mstcecommerce.com દ્વારા ઈએમડીની ૨કમ એમએસટીસી વોલેટમાં જમા કરાવવાની છેલ્લી તારીખ ૧૦.૦૭.૨૦૨૪, **સાંજે ૪:૦૦ વાગ્યા સુધી** રહેશે, ત્યારબાદ જમા કરવામાં આવેલ ઈએમડીને હરાજીમાં ભાગ લેવા માટે ધ્યાનમાં લેવામાં આવશે નહિ.

૪ ઉપરોક્ત ઉપરાંત, પાનકાર્ડ, સરનામાના પૂચવા અને ઓળખના પૂચવા, ઈ-મેલ આઈડી, મોબાઈલ નં. અને કંપનીના કિસ્સામાં કંપનીના બોર્ડ ઓફ ડાયરેકટર્સ દ્વારા પાસ કરવામાં આવેલા બોર્ડ ઠારવની નકલ અથવા કંપનીના પ્રતિનિધિત્વ/એટર્નીને સમર્થન આપતો અન્ય કોઈ દસ્તાવેજ અને આ પ્રકારની ડિપોઝીટની રસીદ/કાઉન્ટર કાઈલ **૧૦.૦૭.૨૦૨૪, સાંજે ૫:૦૦ વાગ્યા સુધી** કે તે પહેલા સોફ્ટકોપીઝ અપલોડ કરીને ઈ-હરાજી વેબસાઈટ દ્વારા ઉક્ત સર્વિસ પ્રોવાઈડર્સને પહોંચવી જોઈએ. અને તે ઉપરાંત

હાર્ડકોપી સાથે ઈએમડી ડીપોઝીટની પહોંચ **રીકવરી ઓફીસર-૧, ડીઆરટી-૧, અમદાવાદ ઓફીસે તા. ૧૦.૦૭.૨૦૨૪** ના રોજ મોકલી આપવાની રહેશે. એવું પણ ઠરાવવામાં આવે છે કે નિષ્કળ બોલીદારોના અર્નેસ્ટમની આજ પેમેન્ટના મોડ દ્વારા આવા બોલીદારના પોતાના ખાતામાં પરત કરાશે. પ સંભવિત ભાવી બોલીદારો આ સર્વિસ પ્રોવાઈડર પાસેથી ઓનલાઈન ટ્રેનીંગ મેળવી શકે છે.

હરાજી એજન્સીનું નામ	મેસર્સ એમએસટીસી લીમીટેડ		
સરનામું	૨૨૫-સી, એ.જે.સી. બોસ રોડ, કલકત્તા - ૭૦૦૦૨૦.		
સંપર્ક વ્યક્તિ	શ્રી સૌરભ કુમાર, મોબાઈલ: +91 9811146516		
હેલ્પલાઈન નંબર	011-41106131 અથવા 18001025026		
વેબસાઈટ અને ઈ-મેલ સરનામું	Website: https://www.mstcecommerce.com	Email: ibapiop@mstcecommerce.com	
હરાજી, મિલકત સંબંધિત પુછ-પરછ માટે સંપર્ક	શ્રી વિનોદ મીના, મો.: +91 7507579015, Email: cs4517@	pnb.co.in	

६ સંભવિત ભાવિ બોલીકારોને તેમની બોલી સુપરત કરતા પહેલા વેચાણની વિસ્તૃત શરતો અને નિયમો અને પ્રક્રીયા જાણવા માટે વેબસાઈટ: https:// www.mstcecommerce.com ની મુલાકાત લઈ શકે છે.

રિઝર્વ કિમતથી નીચેની કિમતે મિલકતનું વેચાણ કરવામા આવશે નહિં

૮ મિલકતો એક લોટમાં વેચવામાં આવશે- જેની રિઝર્વ કિંમત ઉપરોક્ત જણાવેલ છે. બોલીદાર સમગ્ર હરાજી સમયગાળા દરમ્યાન લોટ નં. ૧ માટે રૂા. ૧૦,૦૦૦/- ના એકમમાં ઓફર સુધારી શકશે.

૧૦ મિલકતનો 'જ્યાં છે જેમ છે' તે ધોરણે વેચવામાં આવશે અને ઈ-હારજી એજન્સીની સત્તાવાર વેબસાઈટ પર પ્રસિધ્ધ થયેલા અન્ય શસ્તો અને નિયમોને આધિન રહેશે

૧૧ સર્વોચ્ચ બોલીદારે ચૂકવેલી ઈએમડીના એડજસ્ટમેન્ટ બાદ બેંક કામકાજના બીજા દિવસે સાંજે ૪.૦૦ વાગ્યા સુધીમાં નીચે દર્શાવેલા બેંક ખાતામાં આરટીજીએસ / એનઈએફ્ટી દ્વારા પોતાની આખરે બોલીના ૨કમના ૨૫% જમા કરાવવાના રહેશે.

લાભાર્થી બેંકનું નામ	પંજાબ નેશનલ બેંક	
લાભાર્થીનું નામ	Sundry, NPA, SARFAESI, Auction related	
લાભાર્થીનો એકાઉન્ટ નં.	396600317118A	
આઈએફએસસી કોડ	PUNB0396600	
શાખા	સેટેલાઈટ ચેડ	

૧૨ સફળ બોલીઘર/હરાજી ખરીદઘર મિલકતના વેચાણની તારીખથી ૧૫માં દિવસે કે તે પહેલા વેચાણની રકમની બાકીની ૭૫% રકમ જમા કરાવવાની રહેશે. જો ૧૫મો દિવસ રવિવાર કે અન્ય કોઈ રજા હોય તો ત્યારબાદના પ્રથમ બેંક કામકાજના દિવસે ઉપર જણાવ્યા મુજબના ખાતામાં આરટીજીએસ / એનઈએકટી દ્વારા નાણાં જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત ખરીદનાર કુલ વેચાણ કિંમતના નાણાંના એક ટકાના દરે (વત્તા રૂા. ૧૦) ધ રજીસ્ટ્રાર, પ્રીઆરટી-૧, અમદ્યવાદની તરકેણમાં ગ્રીગ્રી દ્વારા પાઉન્ડેજ ફી ની તરકેણમા તૈયાર કરાયેલ ગ્રેગ્રે રીકવરી ઓફીસર, ગ્રેઆરટી-૧, અમદાવાદને સીધો સુપ્રત કરાશે.

૧૩ નિયત સમયમર્યાદામાં પેમેન્ટ ચૂકવાવામાં કસૂર થશે તો વેચાણના ખર્ચની કપાત કર્યા બાદ નીચે સહી કરનારને યોગ્ય જણાશેતો ડીપોઝીટ સરકારી ખાતામાં જામ કરવામાં આવશે. અને કસુરદાર ખીરદનાર મિલકત કે જમા કરાવેલ રકમ પરના તેના તમામ દાવાઓ જપ્ત કરવામાં આવશે. વેચાણનું નવેસરથી જાહેરનામું જારી કરાયા બાદ મિલકત તત્કાલ ફરીથી વેચવામાં આવશે. વધુમાં ખરીદનાર આખરી બોલીની રકમ અને પાછળથી જે કિંમતે વેંચાયુ તે કિંમત વચ્ચેનો કોઈ શોર્ટ ફોલ કે તફાવત ભરપાઈ કરવા જવાબદાર રહેશે.

૧૪ સફળ બીડરે નોંધ લેવી કે ટીડીએસ અને જીએસટીની જબાવદારી, જો કોઈ હોય તો, સફળ બીડર દ્વારા વેચાણની વિચારણની રકમથી વધુ અને અલગથી વહન રહેશે અને

આ ફોરમ દ્વારા પુષ્ટિ થયેલ વેચાણ વિચારણાની રકમમાંથી બાદ કરવામાં આવશે નહિં.

નીરીક્ષણની તારીખ અને સમય	२७.०६.२०२४	બપોરે ૨.૦૦ થી ૪.૦૦ વાગ્યા સુધી
ઈએમડી/દસ્તાવેજોના પૂરાવા અપલોડ કરવાની છેલ્લી તારીખ	90.09.2028	સાંજે ૫.૦૦ વાગ્યા સુધી
ઈએમડી પ્રુફ અને ડોક્યુમેન્ટ ની હાર્ડકોપી રીકવરી ઓફીસરની ઓફીસએ જમા કરાવવાની છેલ્લી તારીખ	90.09.2028	સાંજે ૫.૦૦ વાગ્યા સુધી
હરાજીની તારીખ અને સમય	92.09.2028	બપોરે ૧૨.૦૦ થી ૧.૦૦ વાગ્યા સુધી. (પાંચ મિનિટના ઓટો એક્સટેન્શન સાથે, વેચાણ સમાપ્ર ન થાય ત્યાં સુધી.

૧૬ રીકવરી ઓફિસરને કોઈપણ જાતના કારણો આપ્યા વગર કોઈપણ બોલી કે બોલીઓ સ્વીકારવાનો કે અસ્વીકારવાનો અથવા ઈ-હરાજી મોક્ફ રાખવાનો કે રદ કરવાનો

આજે તા. ૩૦.૦૪.૨૦૨૪ના રોજ મારા હસ્તાક્ષ અને આ અધિકરણની મહોર સાથે જારી કરાયું



સહી/- (લવ કુમાર) વસૂલાત અધિકારી-૧, ડીઆરટી-૧, અમદાવાદ









તારીખઃ ૨૩.૦૫.૨૦૨૪



આધાર હાઉસીંગ ફાયનાન્સ લીમીટે















